

‘ગાજલવીક્ષ’

વલી ગુજરાતી ગાજલકેન્દ્રનું ટ્રેમાસીક

વર્ષ : ૧ • અંક : એક • માર્ચ : ૨૦૦૭

:સંપાદક:

રાજેશ વ્યાસ ‘મીસ્કીન્ઝ’ • અંકીત ત્રીવેદી

◆ -અંકીત ત્રીવેદી-

ઉધારા બારણો થઈકો થઈને કઈ રીતે આવી?
 તને કહું છું જુનો લહેકો થઈને કઈ રીતે આવી?
 તું તો અજવાળું માફકસરનું પીરસતી રહી કાયમ,
 દીવાની વાટ તું ભડકો થઈને કઈ રીતે આવી?
 ભુલાયેલી ઘણીયે સાંજને પુછું છું રસ્તા પર,
 નર્યા વરસાદમાં તહકો થઈને કઈ રીતે આવી?
 તને દરરોજ જોઉં છું સતત મારા ઉપર હસ્તાં,
 ઉદાસી આજ ઉમળકો થઈને કઈ રીતે આવી?
 પીડા તો છી પીડા જેવી ને એના ભાગ્યમાં હુમો,
 ગાજલમાં આવી તો ટહુકો થઈને કઈ રીતે આવી?

પાન : ૨૫

◆ -ખલીલ ધનતેજવી-

સ્થીર જળ સાથે અટકચાળા ન કર,
 કંકરા નાખીને કુંડાળાં ન કર.
 લોક દીવાળી ભલે ને ઉજવે,
 પેટ બાળીને તું અજવાળાં ન કર.
 આજથી ગાણ આવનારી કાલને,
 પાછલાં વર્ષોના સરવાળા ન કર!
 ક્યાંક પથ્થર ફેંકવાનું મન થશે,
 ઈંટને તોડીને ઢેખાળા ન કર.
 થઈ શકે તો રૂભરૂ આવીને મળ,
 ઉધમાં આવીને ગોટાળા ન કર.
 છે કવીતાઓ બધી મોઢે મને,
 મારી મીલકતનાં તું રખવાળાં ન કર.

પાન : ૩૩

◆ -મુકેશ જોશી-

પાનખરોમાં પાન ખરે ને, જાહનો આખો વાન ખરે ને, ત્યારે સાલું લાગી આવે,
 જંગલને બાળીને બેઠું, હાલકું એકાંત ખરે ને, ત્યારે સાલું લાગી આવે.
 વર્ષોથી પર્વત ચઢનારા માણસની ચારેબાજુ હો ખાઈ ખાઈ ને ઉડી ખીણો,
 એક જ હગલું બાકી હો ને અંતે એનું ધ્યાન ચણે ને, ત્યારે સાલું લાગી આવે.

સામેની કુટપાથ ઉપર સુતાં હો બાળક ભુખ્યાં પેટે આંસુ પીને ઉના શાસે,
સામેની કુટપાથે કોઈ હોટલ આવીશાન મળે ને, ત્યારે સાલું લાગી આવે.
તમે હોવ મશ્તાક, તમારી તલવારો પર, દુશ્મનને પહકારી લાવો રજાની વરચે,
હાથ જરા સરકાવો પાછળ, સાવ જ ખાલી ભ્યાન મળે ને, ત્યારે સાલું લાગી આવે.

પાન : ૫૨

-૨૯૬ મનીઆર-

ગોપીત રહે કદી, કદી સાક્ષાત્ હોય છે,
મારી ગજલમાં તારી રજુઆત હોય છે.
ફરીયાદ લઈને આવું છું હું તારે આંગણો,
નીકળે જે કંઠમાંથી કબુલાત હોય છે.
લાગે છે જ્યારે કંઈ જ જીવનમાં બચ્યું નથી,
જીવનની એ નવી જ શરૂઆત હોય છે.
આપી દે એક વાર...આ જીવન, એ આપનાર,
બાકીની જીંદગી તો વસુલાત હોય છે.
દરીયો જ શાંત હોય એ પુરતું નથી 'રીશા',
ક્યારેક માત્ર નાવમાં ઉત્પાત હોય છે.

પાન : ૫૩

-રતીલાલ 'અનીલ'-

શહેરોમાં રહે છે, જંગલોમાં જાય છે રસ્તો,
કહીં સંસાર માંડે, ક્યાંક સાધુ થાય છે રસ્તો !
અહીંથી સાવ સીધો ને સીધો આ જાય છે રસ્તો,
તમારા ધામ પાસે કેટલો વંકાય છે રસ્તો !
નથી પહતાં કદમ, તારા મીલન માટે નથી પહતાં;
વીના વાંકે બીચારો વીધમાં નીંદાય છે રસ્તો !
પ્રશયના પંથ પર ક્યારેક લહેરાતો હતો પાલવ,
નજર સામે હવે મૃગજળ રૂપે દેખાય છે રસ્તો !
નહીંતર ખીણમાં એ સોંસરો આવી નહીં પહતે,
મુસાફરને શું દેવો દોષ, ઠીકર ખાય છે રસ્તો !
મુસાફર નહીં, નદીમાં એ ન હુબી જાય તે માટે,
બને છે પુલ, સામે પાર પહોંચી જાય છે રસ્તો !
હું ઈશ્વરની કને તો ક્યારનો પહોંચી ગયો હોતે,
અરે, આ મારાં ચરણોમાં બજુ અટવાય છે રસ્તો !

પાન : ૫૫

-રાજેશ વ્યાસ 'મીસ્કીન્ઝ'-

તારું કશું ન હોય તો છોડીને આવ તું,
તારું જ બધું હોય તો છોડી બતાવ તું.

અજવાળું જેને ઓરડે તારા જ નામનું,
હું એ જ ઘર છું એ જ ભલે ને ન આવ તું.
પહેર્યું છે એય તું જ છે ઓફ્યું છે એય તું,
મારો દરેક શબ્દ તું મારો સ્વભાવ તું.
સાકરની જેમ ઓગળી જઈશ હુંય પણ,
ઇલકાતો કટોરો ભલેને મોકલાવ તું.
'મીસ્કીન્' સાત દરીયા કરી પાર એ મળે,
એ રેખા હથેળીમાં નથી તો પડાવ તું.

પાન : ૭૦

-સૌમ્ય જોશી-

ઠોકરની સાથે નામ તુજ લેવાય છે ઈશર,
તું કેવો અકસ્માતથી સર્જય છે ઈશર.
હેઠો મુકાશો હાથ ને લેગા થશે પછી જ,
કોશીષ જ્યાં પતે ત્યાં જ શરૂ થાય છે ઈશર.
જો દુર પેલી વસ્તીમાં ભુખ્યાં છે ભુલકાં,
લાગે છે તને દુરનાં ચરમાંય છે ઈશર.
કે'છે તું પેલા મંદીરે છે હાજરાહજુર,
તું પણ શું ચકાચૈંધથી અંજય છે ઈશર !
થોડાં જગતનાં આંસુઓ, થોડા મરીઝના શે'ર,
લાવ્યો છું જુદી પાર્થના, સંભળાય છે ઈશર?
એનામાં હુંય માનતો થઈ જાઉં છું ત્યારે,
મારામાં જ્યારે માનતો થઈ જાય છે ઈશર.

પાન : ૭૮

-હીતેન આનંદપરા-

બધું જલદી શીખવવાના તારા આયાસ રહેવા દે,
એ બાળક છે એના ખુલ્લાપણાના શાસ રહેવા દે.
પ્રસંગો પર પ્રસંગો એ રીતે બનતા ગયા છે દોસ્ત,
કે હરદમ થાય માણસજાત પર વૌશાસ રહેવા દે.
વધારે હોય પૈસો યાર, તો માણસને ઉભા કર,
તું ઈશરનાં નવાં મંદીર, નવાં આવાસ રહેવા દે.
મને પામે જો વીસ્મયથી હું પળમાં ઉભરી આવું,
ગણીતની જેમ મારો અટપટો અભ્યાસ રહેવા દે.
જરા તું દોસ્તોની ખાનદાનીનો મલાજો કર,
બધાની હાજરીમાં એમનો ઉપહાસ રહેવા દે.
તને પુછ્યું છે તારું નામ, ખાલી નામ બોલી દે,
તું તારાં સાત કુળનો વૈભવી ઈતીહાસ રહેવા દે.

પરમ તૃપ્તિ, પરમ સંતોષ, તારા કામની વસ્તુ,
હું શાયર છું, તું મારા માટે થોડી ઘાસ રહેવા દે.

પાનઃ ૮૫

◆◆◆

ગુજરાતના ઉર્દુ શાયર ‘વલી’(મોહંમદ વલીયુત્લાહ શરીફ મોહંમદ અલવી) ગુજરાતી’, સુઝી સંતના વંશજ હતા અને તેઓ અગીયારમી સદી (હીજરી)ના પુર્વાધ્યમાં અમદાવાદમાં જન્મ્યા હતા. તેમની સ્મૃતીમાં, ગુજરાત રાજ્ય સરકારે સ્થાપેલા ‘વલી ગુજરાતી ગઝલકેન્દ્ર’ના ઉપક્રમે ગઝલના સવર્ગીણ વીકાસ માટે કરવા ધારેલી પ્રવૃત્તિઓમાં આ ‘ગઝલવીશ્ય’ ત્રૈમાસીકનું પ્રકાશન પણ એક અતીમહત્વની પ્રવૃત્તિ છે.

રાજેશ વ્યાસ ‘મીસ્કીન્દુ’ અને અંકીત ત્રીવેદીના સક્ષમ હસ્તે સંપાદીત થયેલા આ સામયીકના પ્રથમ અંકે જ ગઝલરસીયા સૌ વાચકોને ભારે આનંદ આપી તેમની અપેક્ષાઓને ઉશ્કેરી છે.

‘ગઝલવીશ્ય’ના પ્રથમ અંકને ‘અંક’ તો કહેવો પડે એટલે; બાકી એ એક ‘ગઝલ-પુસ્તક’થી ય ઉચ્ચી કક્ષાની સામગ્રીથી સભર છે. ૧૩૬ પાનનું એ ‘પુસ્તક’, એક સો જેટલા નામી-અનામી, વીઘમાન-અવીઘમાન ગઝલકારોની ગઝલ, ચાર આર્ટ પેપર ઉપર શાયરોનાં ચીત્રો અને તેમના ‘હસ્તાક્ષર’... ‘પ્રસ્તાવના’માં સાભીર વટવાનો ગઝલસંગ્રહ ‘ધૂજતી ઘાલી’ • ઉમાશંકર જોશી,
‘આમુખ’માં ‘મધુવન’ના સંપાદન પ્રસંગે • હરીન્દ્ર દવે,
‘સંસ્મરણા’માં ‘સફરના સાથી’ • આસીમ રાંદેરી અને રતીલાલ ‘અનીલ’,
‘છિંદશાસ્ત્ર’માં ‘અરબી પીંગશ વીશે’ • નરીમ,
‘મુલાકાત’માં ‘આઠો જામ ખુમારી’ના સર્જક • વીનોદ જોશી,
‘અવલોકન’માં ‘અંતમુખના ઉદ્ગાર’ • રતીલાલ જોંગી
વગેરે વીભાગોની મુલ્યવાન સામગ્રીથી છલોછલ અને સમૃદ્ધ બન્યો છે.

ખુબીની વાત એ છે કે વર્ષના આવા ચાર અંકો આપનાર સામયીકનું વાર્ષિક લવાજમ માત્ર રૂપીયા ૪૦(ચાળીસ) અને વીદેશમાં રૂપીયા ૫૦૦(પાંચ સો) છે ! ગઝલ રસીયાઓની લાંબા સમયની તરસ આમ વાજબી કરતાંય ઓછા દામે છીપાતાં બને સંપાદકો, પોતાના સંપાદકીયમાં માનનીય મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માની તેમની સાહીત્યપીતીને અભીનંદે છે. ઉપરોક્ત ગઝલો, સંપાદકોની પરવાનગીથી અને અકાદમીના ઋણ સહીત સાભાર અહીં પ્રસ્તુત કરી છે....

--- ઉત્તમ ગજજર (સુરત) અને બળવંત પટેલ (ગાંધીનગર)

લવાજમ મોકલવાનું સરનામું : **શ્રી. વરદરાજ પંડીત**, સભ્યસચીવ, ‘વલી ગુજરાતી ગઝલકેન્દ્ર’, ગુજરાત સાહીત્ય અકાદમી, જુન્નું વીધાનસભા ભવન, સેક્ટર-૧૭, ગાંધીનગર-૩૮૨ ૦૧૭

સાહીત્ય કૃતીઓ મોકલવાનું સરનામું : **શ્રી. રાજેશ વ્યાસ ‘મીસ્કીન્દુ’**, ૧- સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭ : ઈમેઇલ : ghazalsamrat@hotmail.com મોબાઇલ ફોન : 94265 94939

શ્રી. અંકીત ત્રીવેદી, ૭૦૧-સાંચી સનીદી, શ્રી. બી. શાહ કોલેજ સામે, વાસણા બસ સ્ટન્ડ પાસે, વાસણા, અમદાવાદ-૩૮૦ ૦૦૭ : મોબાઇલ ફોન : 93749 86869

ઈમેઇલ : ghazalsamrat@hotmail.com

◆◆◆

‘ઉત્તમ ગજજર’માં અને ‘વીજ્યા’ ફોનમાં અક્ષરાંકન : uttamgajjar@hotmail.com

‘સને ઈ-મહેશીલ’ -- વર્ષ : ત્રીજું -- અંક : ૧૦૪ -- June 3, 2007

♦♦♦

માત્ર પંદર માસના ગાળામાં **3,16,000** જેટલા ભાષાપ્રેમીઓએ અત્યાર સુધીમાં

<http://www.gujaratilexicon.com> લેક્સિકોનની મુલાકાત લીધી. આપને પણ લેક્સિકોનની આ નવી **interface**ની મુલાકાત લેવાનું નીમંત્રણ છે.

આપ સૌના સહયોગ થકી **સન્ડ ઈ-મહેશ્વિલના 5400** જેટલા વાચકો થયા અને રોજ્રોજ નવાં નામો ઉમેરાતાં જાય છે એ પુરવાર કરે છે કે, દેશવીદેશમાં ગુજરાતી વાચનના રસીયા બહુ મોટી સંખ્યામાં છે જ...

સૌનો આભાર..અમારી **સન્ડ ઈ-મહેશ્વિલની** અત્યાર સુધીની જુની સઘળી પોડીએક ફાઈલો અમારી વેબસાઈટ

<http://gujaratilexicon.com/index.php?action=downloadSeM>

પરથી સરળતાશી ડાઉનલોડ થઈ શકશે. આ જ વેબ સાઇટ પરથી **લેક્સિકોન** અને **શ્રી વીપુલ કલ્યાણી** તરફથી લંડનથી પ્રકાશિત થતા **ઓપીનીયનની** અને **શ્રી. પ્રવીણ વાધાણી** (મેટ્બોર્ન-ઓસ્ટ્રેલીયા) તરફથી પ્રકાશિત થતા ‘**માતુભાષા**’ માસીકોની મુલાકાતે પણ જઈ શકશે..

♦♦♦

તળગુજરાતથી દુર, દરીયાપાર વસવા છતાં ગુજરાતી સાહીત્યની સાધના કરતા સર્જકોની કૃતીઓની ‘**સન્ડ ઈ-મહેશ્વિલ**’ના સંપાદનની સઘળી જવાબદારી સ્નેહી **શ્રી. હરનીશભાઈ જાની**એ સહખ્ય સ્વીકારી છે. સૌ સાહીત્યસર્જકોનો અને ભાઈ હરનીશ જાનીનો ખુબ ખુબ આભાર.. વીદેશવાસી સર્જકમીત્રોને પોતાની કૃતી હરનીશભાઈને જ મોકલવા વીનંતી.

Address:

Harnish Jani, 4, Pleasant Drive, **Yardville - NJ - 08620 - USA**

eMail : harnish5@yahoo.com

♦♦♦

‘મારતની ઉર્દુ અને હીન્દી સીવાયની ભાષાઓમાં ગજલની રચનાને વધારે અનુકૂળ બને, એના વજનને વધારે જાળવીને શોભાવી રાંકે એવી બીજી કોઈ ભાષા હોય તો તે ગુજરાતી છે. ઉર્દુ શૈલીની ગજલરચનાને ખીલતી જાળવી રાખનાર કોઈ સાહીત્ય હોય તો તે ગુજરાતી છે.’

-રામપ્રસાદ બક્સી,
નસીમના ‘ધૂપદાન’ સંગહની પ્રસ્તાવનામાંથી

(‘ગજલવીશ’ના સંપાદકોના ‘સંપાદકીય’માંથી સાભાર...પાન : ૪)

♦♦♦

‘ઉત્તમજોહરી’માં અને ‘વીજ્યા’ ફોન્ટમાં અક્ષરાંકન : uttamgajjar@hotmail.com

‘સન્ડ ઈ-મહેશ્વિલ’ -- વર્ષ : ત્રીજું -- અંક : 104 -- June 3, 2007

♦♦♦